

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૯/૦૧/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૦ કેસ કરી, ૧૮ વ્યક્તિઓને ઝડપી, ૮૦ લીટર દેશી દારૂ, ૧૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૬ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૨૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૭/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૯ અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

મંદિરમાંથી ચોરી:-

સમાચાર યાદી નં.૧૯૮/૧૭

ગોમતીપુર: હીમતભાઈ બિજલભાઈ પરમાર શેઠ (રહે. કોઠાવાળા વોરાની ચાલી ડી-૩૦ દવખાના સામે ગોમતીપુર) એ તા.૨૮/૧/૧૭ નારોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૩/૧/૧૭ કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે ગોમતીપુર રાયપુર ભજીયા હાઉસ પાસે આવેલ ગોગા મહારાજના મંદિરની દાનપેટીનું તાળુ તોડી દાનપેટીમાંથી રોકડ રૂપિયા ૧૫૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.આર. જનકાંત ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૯૯/૧૭

વસ્ત્રાપુર: ચંદ્રશેખર ભગવાનદાસ પ્રસાદ (રહે. ત્રીશલા વાટીકા માધવ ફાર્મની ગલીમાં ઝાયડસ હોસ્પિટલ રોડ થલતેજ) એ તા.૨૭/૧/૧૭ રાતના ૮/૩૦ વાગે બોડકદેવ નવી બનેલ કેન્સર સ્ટ્રલીંગ હોસ્પિટલ પાસે જેનોબીયા એપાર્ટમેન્ટ નજીક પોતાની વેગન આર કાર નંબર બીઆર - ૫૨ - ૨૧૪૫ કિમત રૂપિયા ૭૯,૦૦૦/- પાર્ક કરી હતી જેની ચોરી રાતના ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ ચંદ્રશેખર પ્રસાદ એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી જયંતિલાલ મણીલાલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.